

CIMS Cancer Care

Volume-5 | Issue-54 | October 25, 2023

Price : ₹ 5/-



**Marengo CIMS
Hospital**

સ્તળ કેન્સર : આજની માહિતી



પ્રસ્તાવના

ભારત માં શહેર માં રહેતી સ્ત્રીઓ માં જોવા મળતું સૌથી વધુ થતું કેન્સર છે સ્તળ કેન્સર. કમનરીઝે, આ કેન્સર ના કારણે થયેલ બધી જ મૃત્યુઓ માં મૃત્યુ નું સૌથી સામાન્ય કારણ છે. પશ્ચિમી સાહિત્ય એવું સૂચાવે છે કે સ્તળ કેન્સર જે સ્ત્રીઓ ને થાય છે તેઓ માંથી ૭૫%, ૫૦ વર્ષ થી વધુ ઉંમર ના હોય છે અને તેઓ માંથી મોટા ભાગ ની સ્ત્રીઓ હોર્મોન રિસેપ્ટર પોલિટિવ હોય છે. જ્યારે, ઉપલબ્ધ ભારતીય સાહિત્ય એવું સૂચાવે છે કે લગભગ ૫૦% સ્તળ કેન્સર ૫૦ વર્ષ થી નાની ઉંમર ની યુવાન સ્ત્રીઓ માં થાય છે. તેઓ માં થી લગભગ ૨/૩ હોર્મોન રિસેપ્ટર નેગેટિવ હોય છે, જેનો એ અર્થ થાય છે કે તેઓ જલદ પ્રકૃતિ ના છે. હાલ ભારત માં દર વર્ષ સ્તળ કેન્સર ના ૧,૪૪,૦૦૦ નવા દર્દીઓ ના નિદાન થવા ની અપેક્ષા છે.

જોખમ નાં પરિબળો :

સુધારી ન શકાય તેવા પરિબળો :

૧. લિંગ : પુરુષો ના પ્રમાણ માં સ્ત્રીઓ ને સ્તળ કેન્સર નું ૧૦૦ વધુ ગાંધું જોખમ છે.

૨. ઉંમર : જેટલી વધુ ઉંમર, તેટલું જોખમ પણ વધારે

૩. જાતી : પારસી અને ચહુંદી માં સ્તળ કેન્સર નું જોખમ વધારે હોય છે.

૪. પારિવારિક ઇતિહાસ : જો નજીક ના કોઈ સગા ને સ્તળ કેન્સર હોય, તો તે સ્ત્રીમાં સ્તળ કેન્સર થવા નું જોખમ વધારે હોય છે. લોહીના સગપણવાળાને સ્તળ કેન્સર હોવાથી, સ્તળ કેન્સર થવા નું જોખમ બે ગાંધું થઈ જાય છે. જો સ્તળ કેન્સર થયેલ તે સ્ત્રી ને માસિક આવતું હોય અને યુવાન હોય તો જોખમ હજુ વધારે હોય છે.

૫. વારસાગત : બધા જ સ્તળ કેન્સરો માંથી ૫%, વારસા માં મળેલ જુન્સ ના કારણે હોય છે. બે પેટીઓ તેમાં એણ (જેમને લોહીનો સરંધ હોય) જણાને કેન્સર હોય તો એક શંકાસ્પદ જૂથ છે. BRCA1 અને BRCA2 જાણીતા જુન્સ છે જેના કારણે કેન્સર થાય છે. આ મોટા જુન્સ છે અને તેઓ માં ધણી ખામીઓ જોવા મળી છે, જે સ્તળ કેન્સર થવા માટે જવાબદાર છે. આ જુન્સ માં ભેદવા માટે ની ઉરય ક્ષમતા હોય છે અને તેઓ ઓંટોસોમલ ડોમિનન્ટ છે, એટલે કે તેઓ માં બિન-જાતીય રંગસૂપ્તિ

નું પ્રભુત્વ વધારે છે. ઓપરેશન વડે બંને સ્તળો ને કાઢી નાખવા, બંને અંડાશાળો ને કાઢી નાખવા અને ખાસ પ્રકારની દવાથી સ્તળ કેન્સર ના જોખમ ને મોટા પ્રમાણ માં ધટાડો થાય છે. કમનરીઝે, આવા આકરાં પગલાં લીધા પછી પણ સ્તળ કેન્સર થવા નું જોખમ સંપૂર્ણપણે દૂર થતું નથી.

૬. સ્તળ કેન્સર થવા નો વ્યક્તિગત ઇતિહાસ : સ્તળ કેન્સર માંથી સ્વરથ થઈ ને જુવિત રહેલ બધા જ વ્યક્તિઓ ને તેઓ ની બીજા સ્તળ માં કેન્સર થવા નું જોખમ વધારે છે.

૭. માસિક નો ઇતિહાસ : જેઓ માં ૧૨ વર્ષ ની ઉંમર પહેલા માસિક શરીરથિં હોય અને મેનોપોઝ ૫૦ વર્ષ ની ઉંમર પછી આવ્યું હોય તેઓ ને સ્તળ કેન્સર થવા નું વધુ જોખમ રહે છે.

સુધારી શકાય તેવા પરિબળો :

૧. પ્રજનન નો ઇતિહાસ : જેઓ ને કોઈ બાળક ન હોય અથવા ૩૦ વર્ષ ની ઉંમર પછી પહેલું બાળક હોય તેઓ ને સ્તળ કેન્સર નું જોખમ વધુ રહે છે. સ્તળપાન કરાવવા થી સ્તળ કેન્સર થી રક્ષણ મળે છે.

૨. HRT (હોર્મોન રિસ્પોન્સમેન્ટ થેરાપી) : એવી બધી જ સ્ત્રીઓ જેઓ HRT પર છે, તેઓ ને સ્તળ કેન્સર થવા નું જોખમ વધું છે. HRT ને બંધ કર્યા ના ૫ વર્ષ પછી થી આ જોખમ સામાન્ય સ્તરે આવી જાય છે. જે HRT માં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંને હોર્મોન્સ હોય છે, તેઓ વધુ જોખમકારક હોય છે.

૩. ઓરલ કોન્ટ્રાસેટિવ (OC) (પિલ) (મોટે થી લેવા માં આવતી ગર્ભનિરોધક ગોળીઓ) : ૨૦ વર્ષ ની ઉંમર પહેલા અને પહેલા બાળક ના થવા પહેલા આ ગોળીઓ (OC પિલ્સ) ને વધુ લાંબો સમય લેવા થી સ્તળ કેન્સર થવા નું જોખમ વધારે રહે છે. OC ને બંધ કર્યા ના લગભગ ૧૦ વર્ષ પછી થી આ જોખમ સામાન્ય સ્તરે આવી જાય છે.

૪. સ્થૂળતા : વધુ વજન ધરાવતી અને મેદસ્ટી સ્ત્રીઓ, જેઓ નું માસિક બંધ થઈ ગયું છે (મેનોપોઝ આવ્યા પછી નો સમયગાળો), તેઓ ને સ્તળ કેન્સર થવા નું ઉરય જોખમ રહે છે.

રોગ નું પ્રિવેંશન (નિવારણ)

રોગ નું પ્રાઇમરી પ્રિવેંશન (પ્રાથમિક નિવારણ) :

પ્રાઇમરી પ્રિવેંશન (પ્રાથમિક નિવારણ) નું હેતુ છે સ્તળ કેન્સર નું પ્રમાણ નિર્મૂળ કરવું અથવા ધારાડવું. સ્તળ કેન્સર થવા નું ચોક્કસ કારણ ખબર ન હોવા થી, તેનું નિવારણ કરવું હકીકત માં શક્ય નથી. તેમ છતાં, તાજેતર માં, ધણા બધા છસ્તક્ષેપો મળ્યા છે જે સ્તળ થવા ના ભારણ ને ધારાડવા માં મદદ કરે છે. ટેમોક્સિસ્ફેન અને નવી હોર્મોનલ દવાઓ, જેવી કે એનાસસ્ટ્રોગ્લોલ અને લેટ્રોગ્લોલ એવું દર્શાવે છે જે તેઓ સ્તળ કેન્સર ને ઉથલો મારતા અટકાવે છે., કે ઉથલો મોડો કરે છે. આ ઉપરાંત તેઓ બીજા સ્તળ માં કેન્સર થવા ની શક્યતાઓ ને પણ ધારાડ છે. ૬૦% થી વધુ સ્તળ કેન્સર ને આ દવાઓ અટકાવી શકી છે, જે અન્યથા પ્રગત થયું હોત.

સેકેન્ડરી પ્રિવેશન (ભીજા તબક્કાનું નિવારણ)

સ્તન કેન્સર ને તેના પ્રાર્થિક તબક્કા માં શોધી કાઢે છે, કેથી એકદરે કેન્સર પર લાંબો સમય કાબૂ રહેવા ની શક્યતા વધી જાય છે. હાલ માં, (૧) બ્રેસ્ટ્સ (સ્તનો) ની જાત તપાસ (૨) મેમોગ્રાફી (સ્તન ના એક્સ-રે) તથા સોનોગ્રાફી અને (૩) બ્રેસ્ટ્સ (સ્તનો) નું ડોક્ટર દ્વારા કરવા માં આવતી શારીરિક તપાસ આ પ્રણેય સ્તન કેન્સર ને તેના પ્રાર્થિક તબક્કા માં શોધી કાઢવા માં ઉપયોગી સાબિત થયા છે

ડાયગ્નોસ્ટિસ (નિદાન) :

પૂર્વ નિદાન ના પગલાં : ડોક્ટર દ્વારા કરવા માં આવતી સ્તન તપાસ, સાથે મેમોગ્રામ (સ્તન ના એક્સ-રે) અને સોનોગ્રામ (સોનોગ્રાફી) બહુ ઉપયોગી સાધનો છે.

નીચે જણાવેલ પ્રક્રિયાઓ વડે નિદાન કરી શકાય છે :

૧. ફાઈન નીડલ એસ્પિરેશન સાઇટોલોગ્ઝી (FNAC) હવે સ્વીકાર્ય નથી.
૨. કોર નીડલ બાયોપ્સી (નિદાન) : નીડલ બાયોપ્સી (સોય દ્વારા ગાંઠના ટૂકડા મેળવવા) સૌથી ઉત્તમ રસ્તો છે. USG (સોનોગ્રાફી)ની મદદથી નાની ગાંઠ માંથી સરળતાથી ગાંઠના ટૂકડા મેળવી શકાય છે. વધારાની તપાસ જેવી કે ER, PR અને Her2, ગાંઠના ટૂકડા ઉપર કરતું શક્ય છે.
૩. આખી ગાંઠ કાઢી બાયોપ્સી કરવી : કોર નીડલ બાયોપ્સીમાં નિષ્ફળતા મળી હોય તેવા નાની ગાંઠ ધરાવતા દર્દીઓ, આ પ્રક્રિયા માટે ઉમેદવાર છે.

૪. ઓપરેશન દ્વારા ગાંઠનો ટૂકડો કાઢવો

અ. શંકાસ્પદ ટયૂમર / ગાંઠ માં જેમાં કોર નીડલ બાયોપ્સી અનિર્ણયક હોય છે.

બ. સ્તન કેન્સર અન્ય / અંગો માં પ્રસરી ગયું હોય.

ક. ઇન્ફ્લામેટરી સ્તન કેન્સર, જ્યાં ગાંઠ અસ્પષ્ટ હોય છે.

સારવાર :

સર્જરી :

૧. મોડિફિએટ રેડિકલ માર્ટેક્ટોમિ (MRM) સ્તન કેન્સર માટે ની જુનું અને સર્વમાન્ય ઓપરેશન છે, આ ઓપરેશનમાં આખું સ્તન તથા બગલની બદ્ધીજ ગાંઠો કાઢી નાખવામાં આવે છે.
૨. આ રોગ પર કાબૂ ની સાથોસાથ સ્તન બચાવવાનું ઓપરેશન પ્રણાત થતું જાય છે. સ્તન ગાંઠની સાથે આજુબાજુની પેશીનો નિકાલ / ઓંકોપ્લાસ્ટી + બગલની બદ્ધી જ ગાંઠોનો નિકાલ / સેન્ટિનલ ગાંઠનો નિકાલ + રેડીઅશન.થી સ્તન બચાવી રોગ નિર્મૂળ કરી શકાય છે. આ પ્રક્રિયા માટે ના ઉમેદવાર બહુ જ સાવધાની થી પસંદ કરવા જોઈએ કારણ કે આ સારવારમાં સ્તનનો દેખાવ પણ મહત્વનો છે. ગાંઠ સ્તનના કયા ભાગમાં છે, સ્તન ની સાઈગ (કદ) અને ગાંઠ ની સાઈગ (કદ), એકથી વધું ગાંઠો / મેમોગ્રામ અથવા MRI, વગેરે પરિબળો એ નક્કી કરવા માં મદદ કરે છે કે સ્તન ને બચાવતું શક્ય છે કે નહીં. પ્લાસ્ટિક સર્જરી ના સિદ્ધાંત નો ઉપયોગ કરી ને અને સ્તન ની પેશી નું રથાળાંતર કરતું, તેને

ઓંકોપ્લાસ્ટી કહેવાય છે. આજ ના સમય માં, ઓંકોપ્લાસ્ટી સ્તન ને બચાવવા માટે ની સૌથી પ્રખ્યાત રીત છે. લેઝીસિમસ ડોર્સી ફ્લેપ (LD Flap) ગાંઠ ને કાઢવા પછી સ્તન તાલ્કાલિક પુનર્નિર્માણ કરવા માટે મહત્વનો ભાગ ભજવી શકે છે.

૩. સ્તન કાઢી નાખ્યા પછી + અને તેની ડીપ ઇન્ફ્રારેડ એપીગ્લાસ્ટીક આર્ટરી પેડિકલ ફ્લેપ (DIAP) વડે સ્તન નું તલ્કાલ પુનર્નિર્માણ શક્ય છે.

૪. પહેલા કિમોથેરાપી: ખાસ પ્રકારના કેન્સરમાં કિમોથેરાપી ખૂબ અસર કરે છે આ પ્રકારના કેન્સરમાં પહેલા કિમોથેરાપી આપી રોગ નાનો કરી, સ્તન બચાવવાનું ઓપરેશન થઈ શકે છે.

૫. તબીબી રીતે અને સોનોગ્રાફી વડે જ્યારે ભાણવા મળે કે કેન્સર બગલની ગાંઠમાં ગયું નથી ત્યારે “સેન્ટિનલ લીંફ નોડ ની પ્રક્રિયા કરવી જોઈએ. આ પ્રક્રિયા પ્રથમ અસરગ્રસ્ત લીંફ નોડ્સ ને શોધવા માં મદદ કરે છે અને જો તેઓ તાલ્કાલિક તપાસ માં રોગીએ ન હોય, તો બગલની બધી જ ગાંઠ કાઢવાનું ઓપરેશન જરૂરી નથી. આથી ઓપરેશન ને કારણે ઊભી થતી જટિલતાઓ, જેવી કે હાથ માં ગંભીર સોજે, બગલ અને છાતી માં સંવેદના નો અભાવ અને છાતી ના ચનાયુંનો માં નબળાઈ થવાની શક્યતા માં ઘટાડો થાય છે.

કેમોથેરાપી :

કેમોથેરાપી આપવા માટે દર્દી ની મુખ્ય લોહીની નસ માં પોર્ટ (કેમોથેરાપી આપવા માટે નું સાધન) મૂકતું ખૂબ જ જરૂરી છે. કેમોથેરાપી માટે ડોક્સોર્બીસીન/ એપિર્બીસીન આધારિત દવાઓ સૌથી વધુ વપરાય છે. સ્તન કેન્સર માટે વધુ જોખમ ધરાવતા દર્દીઓ માં ટેક્સન્સ પ્રકારની દવાનો ઉપયોગ પણ કરવા માં આવે છે.

હોર્મોનલ સારવાર :

દરેક સ્તન કેન્સરના દર્દીમાં હોર્મોન રિસેપ્ટરો ની તપાસ અનિવાર્ય છે. માસિક ચાલુ હોય તેવી રિસેપ્ટર પોઝિટિવ સ્રીઓ માં ટેમોકસીફેન ૨૦ મીગ્રા ઉપયોગી છે. માસિક બંધ થઈ ગયું હોય તેવી રિસેપ્ટર પોઝિટિવ સ્રીઓ માં એનાસટ્રોગ્લોલ અને લેટ્રેગ્લોલ જેવી દવા જરૂરી રીતે ટેમોકસીફેન ની જર્યા લઈ રહી છે.

બાયોલોજિકલ કમ્પાઉન્ડ (ટ્રાસટ્રુગ્યુમેન્બ) :

Her2Neu પોઝિટિવ કેન્સર પર ટ્રાસટ્રુગ્યુમેન્બ ખૂબ સારી અસર કરે છે. તે આ રોગ ને લાંબા સુધી રોગને કાબૂમાં રાખવા તેમજ જીવન લંબાવવામાં ઉપયોગી છે. હાલ માં, આ દવા એક વર્ષ માટે (૧૭ ડોગ) આપવા ની સલાહ દેવા માં આવે છે.

સોજન્ય

ડૉ. તારંગ પટેલ

MS, MCh, MAMS

સ્તન એન્ડ કેન્સર સર્જરી

(મો) +91 98250 22074

કેન્સરની બે વિશિષ્ટ લાક્ષણિકતા

સામાન્ય રીતે 'કેન્સર' શાંદ એક જ રોગ માટે વપરાય છે. હકીકતમાં કેન્સર એક વ્યાપક શાંદ છે. જે શરીરમાં થતા ધણા રોગોને આવરી લે છે. આ બધા જ રોગોમાં એક બાબત સામાન્ય છે : **અવિરત વૃદ્ધિ.** આ દરેક રોગમાં શરીરના કોઈ કોષ/કોષોમાં સુદ્ધ સ્તર (જુનેટીક / DNA Level) પર કોઈ ફેરફાર થાય છે. જેને કારણે આ કોષ/કોષો શરીરના કુદરતી નિયમોને અનુસરવાને બદલે અવિરત પણ વધવા લાગે છે. આ વૃદ્ધિમાં કોઈ કુદરતી નિયમો લાગુ પડતા નથી. આથી બનતા કોષો, ઉણપવાળા હોય છે. જેથી તે શરીર માટે ઉપયોગી નીવડતા નથી, પરંતુ તેઓ શરીરમાં રહીને શરીરને નુકશાન કરે છે. સામાન્યતઃ આ કોષો સમૂહ બનાવીને ગાંઠ બનાવે છે. જેને કેન્સરની ગાંઠ કણીએ છીએ. (Solid Tumor). અમુક પ્રકારના કેન્સરમાં ગાંઠ કયારેક જ બને છે. (Liquid Cancer/Leukemia)

કેન્સરની લાક્ષણિકતાઓ તેને બીજા રોગોથી અલગ પાડે છે. એમાંની બે મુખ્ય લાક્ષણિકતાઓ છે : "કેન્સર ફેલાઈ શકે છે" અને "કેન્સર ફરી થઈ શકે છે". આ લાક્ષણિકતાઓ વિશે આપણે થોડું વધું જણીએ.

(A) કેન્સરનો ફેલાવ (Cancer Spread)

શરીરમાં મોટાભાગના અંગોમાં કેન્સર થઈ શકે છે. મોટાભાગે આ કેન્સરની શરૂઆત કોઈએક કોષમાં થયેલા જુનેટીક ફેરફાર (Mutation) ને કારણે થાય છે. આ ફેરફારને કારણે ઉદભવેલ કોષોમાં અવિરત વૃદ્ધિ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. જેને કારણે તે એક કોષમાંથી અસંખ્ય કોષોનો સમૂહ બનાવે છે અને અંતમાં તે ગાંઠ તરીકે આપને જોવા મળે છે.

હવે, કેન્સરના કોષોની અવિરત વૃદ્ધિનો આ ગુણધર્મ તેને શરીરમાં ફેલાવવા માટે મદદ કરે છે. કેન્સરનો શરીરમાં મુખ્યત્વે પ્રણ પ્રકારે ફેલાવ થાય છે.

Local Spread / સ્થાનિક ફેલાવ (Primary Site) (T=Tumor)

કેન્સરનો કોષ શરીરના જે અંગમાંથી ઉદભવ્યો છે એ અંગમાંજ ધીરે ધીરે મોટી ગાંઠ કે ચાંદુ બનાવે છે. એટલે કે કેન્સરના કોષના ઉદભવની પ્રાથમિક જગ્યાએ તેના કદમાં વધારો થાય છે.

દા.ત. જુભમાંથી ઉદભવતો કેન્સરનો કોષ ધણા બધાં કોષો બનાવી જુભમાં મોટું ચાંદું અથવા ગાંઠ બનાવે છે. આને આપણે Local Spread કહીશું, અને જુભને એની Primary Site કહીશું એટલે કે જુભનું કેન્સર.

આવી જ રીતે શરીરના મોટાભાગના અંગોમાં આ રીતે ગાંઠ કે ચાંદુ વધીને મોટું થાય છે જેમ કે ગાલ, કાકડા (Tonsil), સ્વરપેટી, ફેફસા, સ્તન, આંતરકું, ગર્ભશાય, પ્રોસ્ટેટ, મગજ વગેરે....

Regional Spread / પ્રાદેશિક ફેલાવ (Secondary Site) (N=Node)

આપણા શરીરમાં કોષોને પોષણ આપવા માટે અને તેનો કચરો દૂર કરવા માટે મુખ્યત્વે બે પ્રકારના પરિભ્રમણ તંત્ર આવેલા છે (૧) રિદિરાભિષરણ તંત્ર (૨) લસિકાવાહીની તંત્ર.

શરીરના કોષોમાંથી ઉત્પન થતા દ્વાર્યો લસિકા મારફતે રિદિર/લોહીમાં ભળે છે. આ લસિકા વિવિધ લસિકાવાહીની મારફતે લસિકાગ્રંથિમાં થઈ રિદિરમાં ભળે છે. આ રસ્તામાં લસિકા ગ્રંથિઓ (Lymph Nodes) એક ચેક પોસ્ટ જેવું કાર્ય કરે છે.

હવે જ્યારે શરીરના કોઈ અંગમાં કેન્સરની ગાંઠ થાય છે ત્યારે ત્યાંથી તેના કેન્સરગ્રસ્ત કોષો આ લસિકા વાહિનીમાં પ્રવેશ કરી નજીકના Lymph Nodes માં ફેલાય છે. ત્યાં જઈ તેઓ ફરી વધે છે. અને નવી ગાંઠ બનાવે છે. જેથી આ Lymph Nodes નું કદ વધે છે. આ પ્રકારના ફેલાવને Regional Spread કહેવાય છે. અને આ Nodes Lku Secondary Site કહેવાય છે.

દા.ત. જુભના કેન્સરનો ગળાના લસિકાગ્રંથિ (Nodes) માં ફેલાવ, સ્તનના કેન્સરનો તે જ બાજુની બગલના લસિકાગ્રંથિ (Nodes) માં ફેલાવ.


Distant Spread (દૂર ફેલાયેલુ કેન્સર) / (Tertiary Site)(M=Metastasis)

જ્યારે કેન્સરનો કોષો લોહીમાં ભળીને શરીરના દૂરના કોઈ અંગમાં પહોંચી જાય છે અને ત્યાં વૃદ્ધિ કરી કેન્સરની ગાંઠ બનાવે છે ત્યારે તેને Distant Spread or Distant metastasis કહેવાય છે.

દા.ત. સ્તનના કેન્સરની ગાંઠ જ્યારે ફેફસા/લીવર/હાઇકડા/મગજ માં ફેલાય છે ત્યારે તેને Distant metastatic Spread કહેવાય છે.

ધણીવખત, કેન્સરના કોષો દૂરની લસિકાગ્રંથિમાં ફેલાય છે. તેને પણ Distant metastatic Spread કહેવાય છે.

દા.ત. જુભના કેન્સરની બિમારીનો છાતીના Lymph Nodes(Mediastinal Nodes) માં ફેલાવ પણ metastatic Spread કહેવાય છે.



(B) કેન્સર ફરી થઈ શકે છે (Cancer Recurrence Risk)

કોઈપણ મનુષ્યને તેના જીવનકાળ દરમિયાન શરીરના કોઈ અંગનું કેન્સર થવાની શક્યતાઓ રહેલી છે. આ શક્યતાઓ એવી જ છે જેવી રીતે કોઈપણ બીજા રોગ થવાની શક્યતાઓ હોય. હા, પણ આ શક્યતાઓ ધણી ઓછી હોય છે. અને એ દરેક પ્રકારના કેન્સર માટે અલગ અલગ હોય છે. આ ઉપરાંત બીજા ધણા બધા પરિબળો પણ આ શક્યતા વધુ ઓછી હોવા માટે જવાબદાર હોય છે. આ પરિબળોમાં ધણા પરિબળો વિશે આપણે કશુ કરી શકતા નથી જેમ કે ઉમર (અમુક પ્રકારના કેન્સર મોટી ઉમરમાં થવાની શક્યતા વધુ હોય છે. દા.ત. પ્રોસ્ટેટ કેન્સર, પરંતુ આપણે ઉમરને વધતા રોકી શકવાના નથી). અમુક પ્રકારના પરિબળો મનુષ્યના હાથમાં હોય છે, જેમ કે તમાકું નું સેવન ન કરવું, સારો ખોરાક ખાવો, પ્રદૂષણથી બને તેટલું દૂર રહેવું.

જેમ સામાન્ય માણસને કેન્સર થવાની શક્યતાઓ (વધુ કે ઓછી) હોય છે તેવી જ રીતે કેન્સરના દર્દીને પણ ફરી પાછું કેન્સર થવાની શક્યતાઓ હોય છે. આ કેન્સર એજ અંગનું હોય શકે અથવા નવી જગ્યાનું પણ હોઈ શકે. જ્યારે કેન્સર એજ અંગનું થાય ત્યારે તેને કેન્સર Recurrence કહીએ છીએ. આ Recurrence વળી પાછું શરીરમાં કોઈપણ જગ્યા (Primary, Secondary, Tertiary Site) પર થઈ શકે છે.

કેન્સર પાછું થવાનું Risk /ભોખમ ધણા પરિબળો પર આધાર રાખે છે. જેમાં મુખ્યત્વે કયા અંગનું છે, કયા સ્ટેજમાં નિદાન થયું છે, કેન્સરના કોષોની કેન્સર ફેલાવો કરવાની પ્રકૃતિ કેવી છે (Cancer

Cell Biology) (Cancer Aggressiveness), કેન્સરની સારવાર બરાબર ઘેઝાનિક રીતે પૂરી કરેલ છે કે નહીં, વગેરે.. આ જોખમ દરેક દર્દી માટે અલગ અલગ હોય છે. આ જોખમ વિશે આપણે ઉપરના વિવિધ પરિબળો મુજબ અંદાજો લગાવી શકીએ છીએ પરંતુ તેનો સચોટ જવાબ આપી શકતા નથી. કોઈ દર્દીને Cancer Recurrence થશે કે નહીં અને કયારે થશે એવા પ્રણોના સચોટ જવાબ આપણે આપી શકતા નથી. હા, તેમના બધા Reports પ્રમાણે આપણે અંદાજો લગાવી શકીએ છીએ. જેમ કે શરૂઆતના સ્ટેજ વાળા દર્દીને કેન્સર પાછું થવાનું ભોખમ તેનાથી વધુ સ્ટેજવાળા કેન્સર કરતાં ઓછું હોય છે. આથી જ કેન્સરના વહેલા નિદાન પર ભાર મૂકવામાં આવે છે (Early Detection) જેમ સ્ટેજ વધે તેમ �Recurrence Rate વધે છે. વળી અમુક અંગોમાં થતા કેન્સરની પ્રકૃતિ બીજા અંગના કેન્સર કરતાં વધુ ઓછી આક્રમક (Aggressive) હોઈ શકે છે. જેમ કે સ્વરપેટીના કેન્સર કરતાં પિતાશય કે સ્વાદુપિંડના કેન્સર વધુ આક્રમક (Aggressive) હોય છે. જેને કારણે તેમાં પાછું થવાનું ભોખમ વધુ હોય છે. કેન્સરની બીજી લાક્ષણિકતાઓ વિશે આપણે આવતા અંકમાં જાણીશું.

સોઝન્ય

ડૉ. મોલિક આર. ભેસદિયા

MBBS, MD (રેડિએશન ઓન્કોલોજી)

રેડિએશન ઓન્કોલોજીઝ (કેન્સર નિષ્ણાંતા)

(મો) +91 99257 85859

We Were We Are....

WE WILL BE FUNCTIONING

CIMS CANCER CENTER

Remained Fully Functional during Lockdown

969

Patients at Cancer OPD

2228

Radiotherapy Fractions

819

Chemotherapies &
Day Care


459

Surgical Oncology
Procedures

For OPD appointment call :

+91-79-4805\2772 1257 Mobile : +91-99792 75555

Time : 9:00 AM - 7:00 PM Email : marengocims.cancer@marengoasia.com



ગાયનેકોલોજિક કેન્સર: આવો કોઈ પણ જતના સંકોચ વગર ખુલ્લીને વાત કરીએ!



ગાયનેકોલોજિક કેન્સર એ શ્રીઓના પ્રજનન અંગોમાં થતા કેન્સર છે. ગાયનેકોલોજિકલ કેન્સરના મુખ્ય પાંચ પ્રકારો હોય છે જેમાં સર્વાઇકલ, અંડાશય, ગર્ભાશય, યોગિમાર્ગ અને વાલ્વર કેન્સરનો સમાવેશ થાય છે. તમામ મહિલાઓને આ કેન્સર થવાનું જોખમ હોય છે.

એક રાષ્ટ્રીય અંદાજ મુજબ, આ વર્ષ લગભગ ૨,૨૦,૦૦૦ મહિલાઓને પ્રણ સૌથી સામાન્ય ગાયનેકોલોજિકલ કેન્સરમાંથી એકનું નિદાન થય શકે છે. જે દર અટી મિનિટે એક કેસ કણી શકાય. આ પ્રકારની જીવળેણતા શ્રીઓના પ્રજનન અંગો સામાન્ય રીતે સર્વિકસ, એન્ડોમેટ્રીયમ અથવા અંડાશયમાં ઉદ્ભવે છે.

જેમાંથી લગભગ અડધા પ્રકારના કેન્સર ટાળી શકાય તેવા હોય છે; જાગરૂકતાનો અભાવ, મોડા નિદાન અને અયોગ્ય સારવારને કારણે ભારતીય મહિલાઓમાં હજુ પણ કેન્સરના લીધે મૂલ્યુદ્ધ વધુ છે.

ચાલો શ્રીઓમાં થતા આ સામાન્ય કેન્સર વિશે જાણીએ કારણ કે સારવાર કરતાં નિવારણ વધુ યોગ્ય છે.

સર્વાઇકલ કેન્સર હકીકતો

સર્વાઇકલ કેન્સર એ ભારતમાં સૌથી સામાન્ય ગાયનેકોલોજિકલ કેન્સર છે. આ કેન્સર ૩૫ થી ૫૦ વર્ષની વય આસપાસ સૌથી વધુ નિદાન થાય છે, પરંતુ આનું જોખમ નાની અને મોટી ઉમરની શ્રીઓને પણ હોય છે. આ એકમાત્ર ગાયનેકોલોજિકલ કેન્સર છે જેના માટે કેન્સર વિરોધી રસી અને અસરકારક સ્ક્રિનિંગ પરીક્ષણો શક્ય છે જે કેન્સરને વહેલા ઓળખી લે છે જેનાથી ઉત્તમ સારવાર થઈ શકે છે.

HPV રસી અને પેપ અથવા HPV સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ નિયમિત કરાવાથી સર્વાઇકલ કેન્સરના જોખમથી બચી શકાય છે. સર્વાઇકલ કેન્સરના નિયંત્રણમાં પ્રાથમિક નિવારણ (HPV સામે રસીકરણ), ડિતીય કક્ષાનું નિવારણ (કેન્સર પહેલાના ગાંધીની તપાસ અને સારવાર), બ્રીજ તણકાનું નિવારણ (ઇન્વેસિવ સર્વાઇકલ કેન્સરનું નિદાન અને સારવાર) અને પેલિએટિવ સંભાળનો સમાવેશ થાય છે.

છોકરીઓ સેક્ટ્યુઅલી એક્ઝિટિવ થાય તે પહેલા તેમને રસી આપવાથી સર્વાઇકલ પ્રી-કેન્સર અને કેન્સરને રોકવા માટે જરૂરી પગાવું છે. ૧૩ થી ૧૪ વર્ષની ઉંમરે નિયમિત HPV રસીકરણની ભલામણ કરવામાં આવે છે, અને તે ૮ થી ૨૬ વર્ષની વય વરદે આપી શકાય છે.

HPV પરીક્ષણ (પ્રાથમિક HPV પરીક્ષણ) દ્વારા નિયમિત સ્ક્રીનિંગ અથવા પેપ ટેસ્ટ (સહ-પરીક્ષણ) મહિત્વપૂર્ણ રહે છે. ૩૦ વર્ષની ઉમરમા મોટા ભાગે સર્વાઇકલ કેન્સરના ટેસ્ટ અને સ્ક્રીનિંગ માટે ભલામણ કરવામાં આવે છે.

ઘણી શ્રીઓમાં શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા નથી. જ્યારે આ લક્ષણો અનુભવાય ત્યારે સર્વાઇકલ કેન્સરના લક્ષણો, ઘણી વખત સામાન્ય ગાયનેકોલોજિકલ તકલીફો સાથે થાય છે અને તેમાં માસિક ચક વરદે

અસામાન્ય રક્તત્રાાવ, પેટ અને/અથવા પેલિએક પીડા, સેક્સ પછી રક્તથાાવ, અતિશાય રાાવ (સામાન્ય રીતે રંગહીન અથવા કચારેક સફેદ) જેવા લક્ષણો શામેલ હોઈ શકે છે.

એન્ડોમેટ્રીયલ કેન્સર હકીકતો

એન્ડોમેટ્રીયલ કેન્સર એ એવું કેન્સર છે જે ગર્ભશયની લાઈનને અસર કરે છે (જ્યાંથી તમારં પિરિયટ આવે છે). મોટાભાગના દર્દીઓનું નિદાન ૫૦ વર્ષની ઉંમર પછી થાય છે. એન્ડોમેટ્રીયલ કેન્સરની ઘટનાઓ મુખ્યત્વે આપણી આધુનિક જીવનશીલી (ઓબેસિટી અને શારીરિક પ્રવૃત્તિના અભાવ) ને કારણે વધી રહી છે.

આપણા આહારમાં સુધારો કરીને અને દરરોજ ૩૦ મિનિટની કસરત કરીને, અમે એન્ડોમેટ્રીયલ કેન્સરના દરમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે (અને પોસ્ટમેનોપોઝલ સ્ટન કેન્સર, કોલોન કેન્સર અને અન્ય પ્રકારના કેન્સરના દરમાં પણ ઘટાડો કરી શકીએ છીએ). નિયમિત વ્યાયામ કરીને, તંદુરસ્ત વજન જાળવીને, જલ પ્રેશર અને જલ સુગરના સ્ટરને નિયંત્રિત કરીને એન્ડોમેટ્રીયલ કેન્સરનું જોખમ ઓછું કરી શકાય છે. મેનોપોઝ પછી રક્તત્રાાવ એ એન્ડોમેટ્રીયલ કેન્સરનું સૌથી સામાન્ય લક્ષણ છે અને તેનું તાત્કાલિક મૂલ્યાંકન કરતું જોઈએ.

અંડાશય અને ફેલોપિયન ટ્યુબ કેન્સર હકીકતો

અંડાશય અને ફેલોપિયન ટ્યુબ કેન્સર સામાન્ય રીતે અંડાશયની સપાઠી પર અથવા અંડાશયમાંથી ગર્ભશય (ગર્ભ) કે જે દંડા વહન કરતી નળીઓમાં શરૂ થાય છે. અંડાશયનું કેન્સર ૪૦ વર્ષથી ઓછી ઉમરની શ્રીઓમાં દુર્લભ છે અને મોટાભાગે મેનોપોઝ પછી આ કેન્સર થવાની શક્યતા વધુ હોય છે. ૧૫% સુધી અંડાશયના કેન્સર એ ફેલોપિયન કેન્સરનું એ કેન્સર નિયંત્રણ એક ભાગ છે જે અમુક જીનીઓમાં વારસાગત ફેરફારો, જેને પરિવર્તન કરીએલાય છે ના લીધે થાય છે.

વારસાગત સ્ટન અને અંડાશયના કેન્સરના સિન્ક્રોમ માટે સૌથી સામાન્ય આનુવંશિક પરિવર્તન મધ્યાત્મા છે અને તેને લોહી અથવા લાળના નમ્બૂના દ્વારા જાળી શકાય છે. અંડાશયના કેન્સરના લક્ષણો પેલિએક અને/અથવા પેટમાં દુખાવો, પેટનું કૂલવું, અથવા વારંવાર પેશાબ આવવી અને ખાવામાં તકલીફ અથવા જડપથી પેટ ભરેલું લાગવું વગેરે છે.

આ જ લક્ષણો કેન્સર સિવાયના અન્ય કારણોસર પણ સામાન્ય રીતે જોવા મળે છે. જ્યારે આ લક્ષણો અંડાશયના કેન્સરને કારણે અનુભવાય છે, ત્યારે તેઓ શરીરમાં સામાન્ય રીતે નોંધપાત્ર ફેરફાર કરે છે, આ લક્ષણો વારંવાર અનુભવાય છે અને વધુ ગંભીર હોય છે. થોડા અઠવાડિયા કરતાં વધુ સમયથી આ લક્ષણોનો દેખાતા હોય તો એ મહિલાઓએ આ લક્ષણોનું મૂલ્યાંકન તેમની આરોગ્ય સંભાળ ટીમ દ્વારા કરાવવું જોઈએ.

આ જ લક્ષણો કેન્સર સિવાયના અન્ય કારણોસર પણ સામાન્ય રીતે જોવા મળે છે. જ્યારે આ લક્ષણો અંડાશયના કેન્સરને કારણે અનુભવાય છે, ત્યારે તેઓ શરીરમાં સામાન્ય રીતે નોંધપાત્ર ફેરફાર કરે છે, આ લક્ષણો વારંવાર અનુભવાય છે અને વધુ ગંભીર હોય છે. થોડા અઠવાડિયા કરતાં વધુ સમયથી આ લક્ષણોનો દેખાતા હોય તો એ મહિલાઓએ આ લક્ષણોનું મૂલ્યાંકન તેમની આરોગ્ય સંભાળ ટીમ દ્વારા કરાવવું જોઈએ.

સૌજન્ય

ડૉ. નિતીન સિંઘલ

MBBS, MS (General Surgery), MCh. (Surgical Oncology)

(TATA Memorial Hospital, Mumbai)

**Head Robotics, GI Oncology &
Gynaec Oncology Program**
(મો) +91 75061 14222

મેરિંગો સિમ્સ હોસ્પિટલ, અમદાવાદ

મેડિકલ ટીમમાં નવા ડૉક્ટરનો સમાવિષ્ટ

ડિપાર્ટમેન્ટ ઓફ કેન્સર કેર



ડૉ. ભાવેશ પારેખ

MBBS, MD, DM

હેડ, મેડિકલ ઓન્કોલોજી

✉ bhavesh.parekh@marengoadia.com

📞 +91 98250 34353

ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયોલોજી



ડૉ. પરેશ આર શાહ

MBBS, MD (Radiology)

કન્સલટન્ટ રેડિયોલોજિસ્ટ

✉ paresh.shah@marengoadia.com

📞 +91-98981 29552

મેરિંગો સિમ્સ હોસ્પિટલ, અમદાવાદ ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે સમગ્ર ભારત માં અગ્રેસર

3rd લંગ ટ્રાન્સપ્લાન્ટ
(ફેફસા)



48th લીવર ટ્રાન્સપ્લાન્ટ



200+ બોર્ન મેરો
ટ્રાન્સપ્લાન્ટ



45th હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ
(હૃદય)



75th કિડની ટ્રાન્સપ્લાન્ટ



For emergency or appointment,
📞 **1800 309 9999**

1827
કોરોનરી એન્જુયોપ્લાસ્ટી
અને સ્ટેન્ટિંગ
(જાન્યુઆરી થી ડિસેમ્બર ૨૦૨૨)

હોસ્પિટલ દ્વારા ૮૮% સફળ પરિણામો
ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં સોથી વધુ

ચોથી સર્વ્શ્રોષ કેથ લેબ
"Azurion 7C20" - Flexvision XL અને
3 ડાયમેન્શનલ એન્સાઇટ પ્રિસિઝન EP મેપિંગ સિસ્ટમથી જાજ



અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી (ACC)
સેન્ટર ઓફ રેક્યોલન્ચ
ભારતમાં પ્રથમ પૈકી એક

1000

થી પણ વધારે
ઓપન હાર્ટ સર્જરી
(જાન્યુઆરી થી ડિસેમ્બર ૨૦૨૨)

CIMS Cancer Care Registered under RNI No. GUJBIL/2017/75574

Published on 25th of every month

**Permitted to post at PSO, Ahmedabad-380002 on the 26th to 30th of every month under
Postal Registration No. AHD-C/100/2023-2025 issued by SSP Ahmedabad valid upto 31st December, 2025**


If Undelivered Please Return to :

CIMS Hospital, Nr. Shukan Mall,
Off Science City Road, Sola, Ahmedabad-380060.
Call : 1800 309 9999

Subscribe "CIMS Cancer Care" : Get your "CIMS Cancer Care", the information of the latest medical updates only ₹ 60/- for one year.

To subscribe pay ₹ 60/- in cash or cheque/DD at CIMS Hospital Pvt. Ltd. Nr. Shukan Mall, Off Science City Road, Sola, Ahmedabad-380060. Phone : +91-79-4805 2823. Cheque/DD should be in the name of : **"CIMS Hospital Pvt. Ltd."**

Please provide your **complete postal address with pincode, phone, mobile and email id** along with your subscription



જડપી અને સરળ, તમારા માટે તમારી સ્વાસ્થ્ય ચાગાને મળ્યું છે એક નવું રૂપ

મેરિંગો સિમ્સ હોસ્પિટલ મોબાઈલ એપ્લિકેશન દર્દીઓ ના ઉપયોગ માટે એક મોબાઈલ એપ્લિકેશન



ઓનલાઇન લેવા માટે
Online ફી ભરો અને તમારો
પરિવાર ને આ એપ્લિકેશન
સાથે જોડો



તમારા ડોક્ટર ને ઓળખો PHC પેકેજ
જુવો અને લીનું ઘણું બધું



સુરક્ષિત રીતે તમારો રિપોર્ટ જુવો
જો આપવાનું સ્ટેટ્સ ને ટ્રેક કરો
અને ઘરે થી સેમ્પલ લેવાનો અનુરોધ કરો

QR કોડ ને સ્કેન કરો

Download on the
App Store

GET IT ON
Google Play



*T&C Apply

તમારી રાહ નો અંત આવ્યો અમારી મોબાઈલ એપ્લિકેશન પર સ્વાસ્થ્ય ની દેખરેખ નો ખુબ સારો અનુભવ કરી તેનો આનંદ લો

Printed and Published by **DEVANG C. BHAVSAR** on behalf of **CIMS HOSPITAL PRIVATE LIMITED** and Printed at Hi-Scan Private Limited, 304, G.I.D.C. Estate, Sarkhej-Bavla Highway, Village - Changodar (Taluka – Sanand, Dist - Ahmedabad) and published from CIMS HOSPITAL PRIVATE LIMITED, Near Shukan Mall, Off Science City Road, Sola, AHMEDABAD - 380060. Editor - **DEVANG C. BHAVSAR**.